

ત્વરિત જાહેરાત માટે

બિગ બ્રેમ્પટન આર્ટિસ્ટ સ્પેસ સર્વે (કલાકારો માટેની જગ્યા સંબંધિત મોટી મોજણી)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 23, 2021) – સીટી ઓફ બ્રેમ્પટનની [આટર્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી \(ACCIDA\)](#) સ્થાનિક કલાકારો અને કળા સંસ્થાઓને [બિગ બ્રેમ્પટન આર્ટિસ્ટ સ્પેસ સર્વે](#) ભરવા કહી રહી છે જે શહેરભરમાં પરવડી શકતી જગ્યાની પલોચ ધરાવવા પર પ્રતિભાવ પૂરો પાડશે. વર્કશોપ્સ બનાવવા, રજૂ કરવા, સગવડમય બનાવવા, ઓફિસો સ્થાપવા, કામગીરીનું પ્રદર્શન અને વેચાણ કરવા જગ્યાની પલોચ ધરાવવી એ બ્રેમ્પટનના કળા સમુદાયની રચનાત્મકતા અને સફળતા માટે નિર્ણાયક બની રહે છે, ખાસ કરીને આ ક્ષેત્ર COVID-19 ની અસરોમાંથી રિકવર થતું હોવાનું જણાય છે ત્યારે.

બિગ બ્રેમ્પટન આર્ટિસ્ટ સ્પેસ સર્વે શુક્રવાર, સપ્ટેમ્બર 24 સુધી ઉપલબ્ધ રહેશે. સહભાગી થતી દરેક વ્યક્તિ Curry's Art Supplies (કરીસ આર્ટ સપ્લાય્સ)નું \$100 નું ગીફ્ટ સર્ટિફિકેટ જીતવામાં પ્રવેશ મેળવશે, અને બધાં કલાકારો અને કળા સંસ્થાઓને સર્વેમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ACCIDA એક અજોડ સંસ્થા છે જેનું સેવન વૈવિધ્યસભર કાર્યક્રમો, સેવાઓ અને સંસાધનો મારફતે કળા ક્ષેત્ર વિકસાવવા, ઉજવવા, હિમાયત કરવા અને જોડાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરનાર સીટી ઓફ બ્રેમ્પટન હેઠળ થઈ રહ્યું છે. કળા સમુદાયનો પ્રતિભાવ રચનાત્મક જગ્યા માટેની જરૂરિયાત સહિત, કાર્યક્રમો અને સહાયતા માટે માર્ગદર્શન મેળવવામાં મદદરૂપ થશે.

ACCIDA કલાકારો માટે જગ્યાની ચર્ચા કરવા ગુરુવાર, ઓગસ્ટ 26 નાં રોજ સાંજે 6:30 થી 8 વાગ્યા સુધી ઓનલાઇન આર્ટિસ્ટ કમ્યુનિટી રાઉન્ડટેબલનું આયોજન કરી રહ્યું છે. આ મફત પ્રસંગ કલાકાર સમુદાયો અને જગ્યાને સહાયરૂપ થવાની રીત પર ચર્ચા કરવા સીટી ઓફ બ્રેમ્પટનની આયોજન અને શહેરી ડિઝાઇનની ટીમો, સંશોધકો અને થિયેટર નિર્માતાઓના પ્રતિનિધિઓ સહિત નિષ્ણાતોની પેનલને સાથે લાવશે. વિગતો મેળવવા અને નોંધણી કરાવવા વેબસાઇટ જુઓ, accida.ca

અવતરણો (ક્વોટ્સ):

“ACCIDA બ્રેમ્પટનના કળા અને સંસ્કૃતિના નક્શાનો આકાર ઘડવામાં અને સહાયરૂપ થવામાં વિશાળ ભૂમિકા ભજવશે. આ પ્રતિભાવ એકઠો કરવો એ આપણાં કલાકારો અને કળા સંસ્થાઓને આગળ વધવામાં સહાયરૂપ થવા નિર્ણાયક બની રહે છે જેથી આપણે આપણાં રચનાત્મક સમુદાયને વધારે સારી રીતે સશક્ત બનાવી શકીએ છીએ. હું દરેક વ્યક્તિને ભાગ લેવા અને તેઓનું મંતવ્ય જણાવવા પ્રોત્સાહિત કરું છું!”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“ACCIDA કળા સમુદાયમાં પોતાનું કામ શરૂ કરે તે જોવા હું રોમાંચિત છું. તેઓનું આબાદ, વિશ્વાસુ અને મૂલ્યવાન રચનાત્મક દૃશ્ય રચવાનું દૂરદેશીપણું મહત્વાકાંક્ષી છે અને તે આ શહેર અને રહેવાસીઓના રોજિંદા જીવન અને ધંધાઓ માટે અત્યંત મૂલ્યવાન બની રહેશે.”

- *રોવિના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; ઉપપ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“બ્રેમ્પટનનો કળા, સંસ્કૃતિ અને રચનાત્મક ઉદ્યોગ આપણાં શહેરની ગતિશીલ રચના (વાઈબ્રન્ટ મોઝેઈક)નો અભિન્ન ભાગ છે. તેઓના કાર્યથી આપણાં સ્થાનિક કલાકારો અને કળા સંસ્થાઓને સહાય કરવામાં મદદ મળશે જેથી કરીને તેઓ બ્રેમ્પટનને ઘર તરીકે ઓળખવામાં ગૌરવ અનુભવે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈથ (Prabhjot Kainth)

કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca